

- ૧) સાફલ્ય ગાથા (ફોટાઓ સાથે)
- ૨) સુરક્ષા સેનુ અંતર્ગત થયેલ કાર્યક્રમો તથા તેને અનુરૂપ ફોટાઓ વિગત

નવસારી જીલ્લા પોલીસ ધ્વારા મહિલા સુરક્ષા સમિતના સભ્યો, તાલુકા મહિલા સુરક્ષાના સભ્યો તેમજ તમામ પોલીસ અધિકારીઓ સાથે મિટીંગનું; આયોજન કરવામાં આવેલ.



પોલીસ કંટ્રોલ રૂમ નવસારીના વી.એચ.એફ. મેસેજને આધારે દેશી હાથ બનાવટની પિસ્તોલ(અગ્ની શસ્ત્ર) હથિયાર પરવાના વગર ગેરકાયદેસર રાખી ત્રણ આરોપીને બહાદુરી પુર્વક પકડી પાડતી નવસારી રૂરલ પોલીસની ટીમ.

નવસારી કંટ્રોલ રૂમ તરફથી નવસારી રૂરલ પો.સ્ટે.ની પી.સી.આર.વાનમાં ફરજ બજાવતા અ.હે.કો નરેશચંદ્ર નારસિંહ બ.નં.૫૮૧ નાઓને મેસેજ મળેલ કે વલસાડ તરફથી એક વેગનઆર કાર નં.MH-05-BJ-2737 ની ગ્રે કલરની નવસારી તરફ આવે છે જેમા શકમંદ ઇસમો હોય, તેને બોરીયાચ ટોલનાકા ખાતે જઈ તેને અટકાવશો જેવી હકિકત મળતા નવસારી રૂરલ પી.સી.આરમાં સાથેના પો.કો.અનિલભાઈ રમેશભાઈ બ.નં.૪૭૫ તથા ડ્રા.હે.કો હેમંતભાઈ ગમનભાઈ નાઓની સાથે બોરીયાચ ટોલનાકા ખાતે પહોચી ટોલનાકા વી.આઇ.પી ટ્રેક ઉપર કંટ્રોલ રૂમ તરફથી વર્દીમાં જણાવેલ વેગેનઆર કાર નં.MH-05-BJ-2737 ને આવતા જોઈ જતા બોરીયાચ ટોલનાકા ખાતે ફરજ પરના પો.કો હિરેનભાઈ હર્ષદ તથા પો.સ.ઇ ટી.આર.ચૌધરી સાથે સદર કારને સાઇડમાં રોકી જોતા ત્રણ ઇસમો બેસેલા હોય જેઓના નામઠામ પુછતા(૧) ઇરફાન સલીમ શેખ રહે. શેખ ગુલામ હુસેન ચાલ રૂ.નં.૪૬૦/૧ નીચર માતૃછાયા નિવાસ અશોક નગર વાલદુની કલ્યાણ વેસ્ટ મહારાષ્ટ્ર તથા(૨) વિકાંત પ્રકાશ જાધવ રહે.૧૮૦૩ ન્યુ એરા યોગીધામ મહાત્મા પોલીસ ચોકી પાસે કલ્યાણ વેસ્ટ મહારાષ્ટ્રનો તથા (૩)રાહુલ બાબુ ડોંગરે રહે.ઇસ્ટ ઉલ્લાસનગર ભીમ કોલની ઓટી સેક્સન મહારાષ્ટ્રનો હોવાનું જણાવેલ અને જેઓની અંગ ઝડતી કરતા તેમાના વિકાંત પ્રકાશ જાધવના પેન્ટના ખીસામાંથી એક સીલ્વર કલરની દેશી હાથ

બનાવટની અઝ્ની શસ્ત્ર પિસ્તોલ મળી આવેલ જે પિસ્તોલ રાખવા બાબતે પકડાયેલ ત્રણે ઇસમોની પાસે હથીયાર પરવાનાની માંગણી કરતા તેઓએ નહી હોવાનું જણાવતા પિસ્તોલ(અઝ્ની શસ્ત્ર)ની કિ.રૂ.૨૫,૦૦૦/-જેટલી ગણી તથા એક ક્લાસીક કંપનીનો KL101 મોબાઇલ જેની કિ.રૂ.૫૦૦/- તથા બીજો મોબાઇલ આઇટેલ કંપનીનો કિ.રૂ.૫૦૦/- તથા એક એરટેલ કંપનીનું સીમ કાર્ડ કિ.રૂ.૦૦/-ગણી તથા એક પેનડ્રાઇવ જેની કિ.રૂ.૦૦/- તથા વેગનઆર કાર નં. MH-05-BJ-2737 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ગણી તથા બીજા ઇસમ પાસેથી સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ ન્યુયો કંપનીનો મોબાઇલ જેની કિ.રૂ.૧,૦૦૦/- ગણી કુલ રૂ.૧,૨૭,૦૦૦/-નો મુદ્દામાલ હથીયાર પરવાના વગર નવસારી રૂરલ પોલીસની ટીમે પકડી પાડતા પો.સ.ઇ.શ્રી ટી.આર.ચૌધરી નાઓએ કાયદેસરની કાર્યવાહી કરી નવસારી રૂરલ પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.જી.દેસાઇ નવસારી રૂરલ પો.સ્ટે.નાઓએ હાથ ધરેલ છે.



મુદા નંબર (૧)

- જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ.
 - નવસારી જીલ્લા પોલીસ ધ્વારા વર્ષ ૨૦૦૭ થી આજદિન સુધીના ગુમ થયેલ બાળકો/વ્યક્તિઓ શોધવા અંગે મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.
 - ગુમ/અપહરણ થયેલ બાળકોની ભારત સરકાર ધ્વારા શરૂ કરવામાં આવેલ વેબસાઇટ <http://trackthemissingchild.gov.in/missing/index.php> ઉપર રોજ રોજ એન્ટ્રી કરવામાં આવે છે.
 - પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્તાર, નવસારી રૂરલ, જલારાપોર વિસ્તારમાં તાલીમ બદ્ધ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરૂ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્પ મળી રહે.
 - ગુમ થયેલ બાળકો અંગે જીલ્લાની મહીલા સુરક્ષા સમિતીની મહીલાઓ તેમજ એન.જી.ઓ. યાઇલ્ડ વેલ્ફેર ઓફીસર તેમજ જીલ્લાના તમામ અધિકારીઓ સાથે મીટીંગો કરવામાં આવે છે.

મુદા નંબર (૩)

- ટ્રાફિક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.
- ટ્રાફિક સપ્તાહની ઉવજણી કરવામાં આવી રહેલ છે. ટ્રાફિક અવેરનસ અંગે શાળા કોલેજોમાં કાર્યક્રમો કરવામાં આવે છે.
- ટ્રાફિક જનજાગૃતિ અંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી ટ્રાફિકના નિયમો સાથેની જાહેર જગ્યાઓ તેમજ શાળા કોલેજોમાં આર.ટી.ઓની મદદથી અવેરનસ કાર્યક્રમો રાખવામાં આવેલ.
- વારંવાર રોડ ઉપર ટ્રાફિક ડ્રાઇવ રાખી ટ્રાફિક અવેરનસ અંગેની સમજ આપવામાં આવે છે.

મુદા નંબર (૪)

- ગુનાઓ અટકાવવા કોઈ વિશિષ્ટ કામગીરી/સ્ક્રેટેજી અપનાવવામાં આવેલ છે ?
- નેશનલ ૮ તેમજ અન્ય રસ્તાઓ ઉપર એક્સીડન્ટ ઝોન નક્કી કરી રોડ એક્સીડન્ટ, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારુ સાઇનબોર્ડ, લગાડવામાં આવેલ છે.
- દરેક પોલીસ સ્ટેશન ખાતે ગૃહ વિભાગ ધ્વારા કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે.
- નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નાઇટ રાઉન્ડ દરમિયાન સેક્ટરવાઇઝ કોસ પેટ્રોલીંગ કરવામાં આવે છે. હોટલો, ઢાબા, તેમજ વાહનોનું ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.
- વારંવાર કોમ્પીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.
- કાઇમ ઇન્વેસ્ટીગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્વેસ્ટીગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

મુદા નંબર (૫)

- અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો.
- સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે એસ.પી.સી. ના બાળકોને વિવિધ પ્રકારની તાલીમ કેમ્પ, સેમિનારનું આયોજન કરવામાં આવે છે.